



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૬/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૦૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૬ કેસ કરી, ૪૫ વ્યક્તિઓને ઝડપી, ૧૦૫ લીટર દેશી દારૂ, ૧૦૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૪૯ બિયર ટીન અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૬૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૦૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૪ વ્યક્તિઓની અને પાસ હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ધરફોડ :-

સમાચાર યાદી નં.૧૦૦૩/૧૯

શહેરકોટડા: મનોજભાઈ ગોપાલદાસ પટેલ (રહે.નારાયણ એપાર્ટમેન્ટ ભગવતી સ્કુલ પાછળ હીરાવાડી બાપુનગર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૬/૧૯ કલાક ૦૦/૩૦ થી સવારના ૭/૦૦ વાગ્યા દરમિયાન નરોડા રોડ મેમ્કો, વિજય એસ્ટેટ સામે, શેડ નં. એ/૨ ખાતે આવેલ પોતાના “શુભ એસ્ટેટ” ના કારખાનાનું શટર ઉંચું કરી અજાણી વ્યક્તિ કારખાનામાં પ્રવેશ કરી આશરે ૯૦ કિલો કોપર વાયર ટેલ કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી ચાવડા ચલાવે છે.

ઇસનપુર: ચીરાગભાઈ જ્યંતિભાઈ ભાવસાર (રહે.કમલસાગર સોસાયટી, કેડીલા લેબની બાજુમા ઘોડાસર) એ તા.૧૧/૦૬/૧૯ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૫/૧૯ સાંજના ૬/૩૦ થી ૭/૧૫ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાના મકાનના ઉપરના માળના રૂમના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-, મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૭,૦૦૦/-, સ્માર્ટ વોચ કિંમત રૂપિયા ૧૪,૦૦૦/-, જીઓનુ ડોંગલ કિંમત રૂપિયા ૫૦૦/-, સોની કંપનીનો કેમેરો કિંમત રૂપિયા ૩,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૪,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૦૪/૧૯

વસ્ત્રાપુર: રાજુલબહેન ડો/ઓ દિલસુખરાય દેવમુરારી (ઉ.વ.૪૨) (રહે. ભાસ્કર ફ્લેટ સ્વામિનારાયણ મ્યુઝીયમ,મીરા અમ્બીકા રોડ નારણપુરા) તા.૧૧/૦૬/૧૯ સાજના ૬/૪૫ વાગ્યાના સુમારે વસ્ત્રાપુર આલ્ફાવન મોલથી રીક્ષામાં બેસીને જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક સફેદ રંગના એક્સેસ કે એક્ટીવા જેવા સ્ફટર ઉપર આવેલ પુરૂષે સ્ફટર રીક્ષા નજીક લાવી રાજુલબહેનની બેગ ઝુટવી લઈ નાસી ગયો હતો. બેગમાં સોનાની ડાયમંડવાળી પેડલ સેટ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- તેમજ જરૂરી દસ્તાવેજ હતા. આ અંગેની ફરીયાદ રાજુલબહેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એચ.રાવલ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૦૦૫/૧૯

નવરંગપુરા: મિલન જયપ્રકાશ દોશી (ઉ.વ.૩૮)(રહે.વાઈસ રોય વિલા, જજીસ બંગલો ચાર રસ્તા પાસે, બોડકદેવ) એ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૬/૧૯ સાંજના ૬/૧૦ વાગ્યાના સુમારે નવરંગપુરા સમર્પણ ચાર રસ્તા, આઈ.ડી.બી.આઈ બેંક નજીકથી કાર ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યો મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ અને તેની પાછળ બેસેલ સ્ત્રીએ મિલનભાઈને તેઓના મોટર સાયકલ સાથે અકસ્માત કરી પગમાં ઈજા પહોંચાડી હોવાનું કહી, મિલનભાઈને કારમાંથી નીચે ઉતરી ઈજાવાળો પગ જોવાનું જણાવી, મિલનભાઈની નજર ચુકવી તેમની કારમાંથી બેગ ચોરી કરી લીધી હતી. બેગમાં રોકડ રૂપિયા ૬,૦૦,૦૦૦/- હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.પરમાર ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૦૬/૧૯

ઓઢવ: રાકેશભાઈ દિનેશભાઈ ધરજીયા (ઉ.વ.૧૮) (રહે. ગુરૂકુળ મેમનગર) ઓઢવ સીંગરવા શબરી હોટલની બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર નીર્માત સ્કવેર દુકાન નંબર-૨૩ ખાતે રહેતા રાકેશભાઈના મોટાભાઈના રહેણાંકમાં અગમ્ય કારણસર તા.૧૧/૬/૧૯ સાજના ૬/૦૦ વાગ્યાના સુમારે પંખાના હુકમાં ચાદર બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કાંતિલાલ જીવાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.